

# નગર આયોજન અને મુલ્યાંકન ખાતુ

## અમદાવાદ શાખા કચેરી

બહુમાળી ભવન-૨, ચોથો માળ, વસ્ત્રાપુર સરકારી વસાહત પાસે, ફ્રાઇવ ઇન રોડ, અમદાવાદ-૩૮૦૦૫૨.

Email:-tpvd.ahdbranch@gmail.com

ટેલીફોન નં. ૦૭૯ ૨૭૯૧૦૧૫૫

નં. એન. એ. બી. પી. / રતનપુર / ધંધુકા / ૨૦૨૪ / ૧૧૨૭

તા. ૧૧ / ૦૭ / ૨૦૨૪.

પ્રતિ

શ્રી. પ્રજાપતિ ઉમરાવકુમાર સીતારામભાઈ તથા અન્ય,  
૨૪૬, રાજધાની ટાઉનશીપ રામોસણા-૩, રામોસણા,  
તાઃ - મહેસાણા, જી. મહેસાણા-૩૮૪૨૦૯

વિષય:- મોજે. રતનપુર, તાઃ - ધંધુકા, જી. - અમદાવાદ. સી. સ. નં. NA336 ની જમીનમાં તાંત્રિક અભિપ્રાય બાબત.

સંદર્ભ:- આપણીની તા. ૧૧/૦૫/૨૦૨૪ તેમજ તા. ૧૦/૦૭/૨૦૨૪ની અરજી અન્વયે.

શ્રીમાન,

ઉપરોક્ત વિષયાન્વયે જણાવવાનું કે, મોજે. રતનપુર, તાઃ - ધંધુકા, જી. - અમદાવાદ. સી. સ. નં. NA336 ની ૨૪૭૧૩.૦૦ ચો. મી. જમીનમાં રહેણાંક હેતુ માટેના લે-આઉટ પ્લાન તાંત્રિક ચકાસણી સારુ આપે અતે રજુ કરેલ છે. સદર જમીનના લે-આઉટ પ્લાનને સક્ષમ અધિકારીશ્રી દ્વારા મંજુર કરવા બાબતે અતેનો તાંત્રિક અભિપ્રાય નીચે દર્શાવેલ શરતોને આધિન આપવામાં આવે છે.

### શરતો:

- સૌ પ્રથમ સદર જમીનમાં સદર સુચિત હેતુ બાબતે જિલ્લા કલેક્ટરશ્રી પાસેથી બિનખેતીની મંજુરી મેળવી લેવાની રહેશે તથા તેની શરતોને આધીન જરૂરી લાગતી પ્રક્રિયા કરવાની રહેશે અને ત્યારબાદ જ બાંધકામ કરવાનું રહેશે.
- અરજદારશ્રી દ્વારા રજુ કરેલ જિલ્લા કલેક્ટરશ્રી. અમદાવાદના હુકમ નં. P.૧૩૬/૧૧/૦૪૧/૨૦૨૨, તા. ૦૨/૦૬/૨૦૨૨ ના બિનખેતી હુકમમાં જણાવેલ તમામ શરતોનું પાલન કરવાનું રહેશે.
- અરજદારશ્રી દ્વારા રજુ કરેલ ડી.આઇ.એલ.આર. કચેરી, અમદાવાદની તા. ૦૫/૦૯/૨૦૨૩ ની (એમ.આર.સ્પે.નં. ૨૮૨/૨૩-૨૪)ની માપણી શીટ મુજબ દર્શાવેલ, કાળી સંંગ લીટી મુજબની મોજે. રતનપુર, તાઃ - ધંધુકા, જી. - અમદાવાદ. સી. સ. નં. NA336 ની હદ પ્રમાણે મુજબ સદર તાંત્રિક અભિપ્રાય આપવામાં આવેલ છે, સવાલવાળી જમીનની હદો તથા સુચિત પ્લોટો સહિતની અધિકૃત ફેર માપણી સંબંધિત દ્વારા કરાવી લેવાની રહેશે જો હદો / વિગતોમાં વિસ્ંગતતા ઉપસ્થિત થાય તો આ અભિપ્રાય રદ ગણવાનો રહેશે તથા અતેનો ફેર અભિપ્રાય મેળવી તેને આધિન જ બાંધકામ પરવાનગી અંગેની આગામી કાર્યવાહી કરવાની રહેશે.
- સવાલવાળી જમીનમાં ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, ૧૯૭૯ ની જોગવાઈ ફેઠળ હાલની સ્થિતિએ કોઈ વિકાસ યોજના બનેલ નથી. જેથી સવાલવાળી જમીનમાં ઓનીંગની કોઈ દરખાસ્ત નથી. સવાલવાળી જમીનને સરકારશ્રીના પ્રવર્તમાન સંકલિત સામાન્ય વિકાસ નિયંત્રણ વિનિયમો-૨૦૧૭ મુજબ ડી-૧૦ કેટેગરીમાં ધ્યાને લઇને સદરું તાંત્રિક અભિપ્રાય આપવામાં આવે છે.
- પ્રસ્તુત પ્રકરણે અતેથી ફાલે કોઈ પ્રકારની વિકાસ પરવાનગી કે બાંધકામ પરવાનગી આપવામાં આવેલ નથી. આ ફક્ત લે-આઉટ પ્લાનનો તાંત્રિક અભિપ્રાય છે તથા આનાથી બાંધકામની મંજુરી મળતી નથી. સંબંધિત સ્થાનિક સંસ્થા પાસેથી જે તે પ્રકારની બાંધકામ પરવાનગી/રજાચીહી મેળવી લેવાની રહેશે. વપરાશ પ્રમાણપત્ર મેળવ્યા બાદ જ વપરાશ ચાલુ કરવાનો રહેશે.
- સવાલવાળી જમીનને સંબંધિત સ્થાનિક સંસ્થાએ બાંધકામ પરવાનગી આપતા પહેલા અતેથી આપેલ તાંત્રિક અભિપ્રાયનો હેતુ તથા કલેક્ટરશ્રી/જલ્લા/ તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા પાઠવેલ બિનખેતી હુકમમાં જણાવેલ હેતુ સુસંગત કર્યા બાદ જ બાંધકામ પરવાનગી બાબતે નિર્ણય લેવાનો રહેશે.

૭. સવાલવાળી જમીનમાં જો રી સરેની કામગીરી પૂર્ણ થઈ અમલમાં હોઈ અને તેને લઈને જમીનની હદ કે ક્ષેત્રફળ માં કોઇપણ ફેરફાર થતો હોય તો તે મુજબનો અત્રેની કચેરીનો ફેર અભિપ્રાય મેળવી લેવાનો રહેશે.
૮. આ અભિપ્રાયના કારણે સવાલવાળી જમીનમાં અરજદારની માલિકી તથા જમીન હદ વિસ્તાર તથા ક્ષેત્રફળ અંગેની મંજુરી મળતી નથી. પરંતુ નિયમાનુસાર લે-આઉટ પ્લાન અંગેનો તાંત્રિક જ અભિપ્રાય આપવામાં આવેલ છે. અરજદારની માલિકી તથા જમીનની હદ, વિસ્તાર, ક્ષેત્રફળ અંગે સંબંધિત ખાતા પાસેથી ચકાસણી કરાવવાની રહેશે અને જો તેમાં વિસંગતતા જણાય તો સદર અભિપ્રાય રદ ગણવાનો રહેશે.
૯. સવાલવાળી જમીનમાંથી અથવા નજીકથી પસાર થતાં વર્ગીકૃત રસ્તાથી છોડવા પડતા અંતર માટે સંબંધિત ખાતા પાસેથી વાંધા રહિત પ્રમાણપત્ર મેળવવાનું રહેશે અને તે પ્રમાણે સ્થળ પર અંતર છોડી બાંધકામ કરવાનું રહેશે.
૧૦. લે-આઉટ પ્લાનમાં દર્શાવેલ માર્જિન તથા ખુલ્લી જગ્યાઓ સ્થળ ઉપર છોડવાની સંપૂર્ણ જવાબદારી જમીન માલિકની રહેશે.
૧૧. સવાલવાળી જમીનમાંથી અથવા નજીકથી પસાર થતી / અરજદારશ્રી દ્વારા રજુ કરેલ માપણાશીટ / પ્લોટ બુક / ટીપ્પણમાં દર્શાવેલ હોય/કે ન દર્શાવેલ હોય તેવી, સવાલવાળી જમીનોમાં હ્યાત ફાઇટેન્શન/ ઇલેક્ટ્રોનિક લાઇન, વર્ગીકૃત રસ્તા, ડેનાલ/ વોટર કોર્સ/ નદી/ વહેણા/ તળાવ કે અન્ય વોટર બોડી, રેલ્વે લાઇન, તેલ/ ઓ.એન.જી.સી. કુવા, પાઇપ લાઇન, ગેસ લાઇન, પેટ્રોલીયમ લાઇન વિગેરેની હ્યાતી તથા મધ્ય કે હદ રેખાથી છોડવી પડતી કન્નોલ લાઇન તથા માર્જિન અંતરો બાબત અંગે સંબંધિત સક્ષમ અધિકારીશ્રીનો અભિપ્રાય મેળવ્યા બાદ જ તે મુજબ સ્થળ પર અંતર છોડી બાંધકામ કરવાનું રહેશે.તેમજ તેમાં વિસંગતતા ઉદ્ભવેથી અત્રેની કચેરીનો અભિપ્રાય રદ ગણવાનો રહેશે.
૧૨. લે-આઉટ પ્લાનમાં દર્શાવ્યા મુજબ બાંધકામના માપો,માર્જિનના અંતરો,રસ્તાની લંબાઈ/પહોળાઈ,બાંધકામ નિયંત્રણ રેખા વિગેરેના માપો સ્થળ પર લે-આઉટ પ્લાન મુજબ મળી રહેતા હોય તો જ જમીન માલિકશ્રીએ બાંધકામ કરવાનું રહેશે.
૧૩. લે-આઉટ પ્લાનનો તાંત્રિક અભિપ્રાય ફક્ત જ તે સરેના નંબર/બ્લોક નંબર અથવા પ્લોટની જમીન પુરતો જ આપવામાં આવેલ છે.
૧૪. સવાલવાળી જમીનમાં આવવા જવા માટેના કાયદેસરના રસ્તા/પ્રવેશ અંગેની સ્થળે ચકાસણી સંબંધિત સક્ષમ અધિકારીશ્રી પાસેથી જમીન માલિક દ્વારા કરાવી લેવાની રહેશે.
૧૫. ઉદ્યોગ ખાતાના જ તે સંબંધિત અધિકારીશ્રીનો અભિપ્રાય મેળવી લેવાનો રહેશે.
૧૬. પ્રદૂષણ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સક્ષમ સત્તાઅધિકારીશ્રીનું ના વાંધા પ્રમાણપત્ર / અભિપ્રાય મેળવી લેવાનો રહેશે.
૧૭. લે-આઉટ પ્લાનમાં દર્શાવેલ કોમન પ્લોટની માલિકી સહિયારી રહેશે.
૧૮. સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના તા.૨૬-૦૫-૨૦૦૧ ના હુકમ નં.પરચ/૧૦૨૦૦૧/૪૫૫/લ તથા વખતો વખત સરકારશ્રી દ્વારા થયેલ હુકમો ની જોગવાઈઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
૧૯. સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના હુકમ નં. પરચ-૧૦૨૦૦૪-૧૯૯૧-લ, તારીખ: ૨૭-૦૭-૨૦૦૪ના વખતો વખત સરકારશ્રી દ્વારા થયેલ હુકમો અન્વયે વરસાઈ પાણીના ભૂતળવહન માટેની જોગવાઈઓ કરવાની રહેશે.
૨૦. એક કરતાં વધારે રે.સ.ન./બ્લોક નં. માટે સંયુક્ત લે-આઉટ નકશો/બાંધકામ નકશાના કિસ્સાઓમાં બાંધકામ મંજુરી/બાંધકામ કરતા પહેલા સંબંધિત અધિકારી/કચેરી પાસેથી એકત્રિકરણ કરાવી લેવાનું રહેશે.
૨૧. લે-આઉટ પ્લાનમાં દર્શાવેલ કોસ ઓવર રોડ જાહેર રસ્તા તરીકે રહેશે તથા સરકારશ્રીના અન્ય લાગુ હુકમોની જોગવાઈઓ/નિયમાનુસાર અમલીકરણ કરવાનું રહેશે.
૨૨. આ અભિપ્રાયથી સવાલવાળી જમીનમાં સ્થળ પર જો કોઇ હ્યાત બાંધકામ હોય તો તેની પરવાનગી તથા મંજુરી મળતી નથી. જેથી સ્થળ પરના હ્યાત બાંધકામની સક્ષમ અધિકારીશ્રી દ્વારા ખાતરી/ચકાસણી કરાવી તે મુજબની આગળની કાર્યવાહી કરવાની રહેશે.
૨૩. મોઝે: રતનપુર ના હ્યાત વિકાસને ધ્યાને લઈ સૂચિત સદર વિકાસ અથે જાહેર હિતમાં સરકારશ્રીની અમલી નિતિઓ મુજબ પૂરી પાડવાની થતી પાચાની સુવિધાઓ જેવી કે રસ્તા, પાણી, ગટર, વરસાઈ પાણીનો નિકાલ, પાતાળકવા/શોખા કુવા, ટ્રાફિક તથા અન્ય બાબતો ધ્યાને લઈ ત્યારબાદ જ યોગ્ય જણાય તો જ આગળની કાર્યવાહી થાય.
૨૪. સવાલવાળી જમીનમાં આંતરમાળખાકીય સવલતો(પાણી,ગટર,સ્ટ્રીટ લાઇટ, સોલીડ વેસ્ટના નિકાલ માટે) જાળવણી/ નિભાવણી ની યોગ્ય વ્યવસ્થા ડેવલપર/જમીન માલિકશ્રીએ કરવાની રહેશે.


૨૫. સવાલવાળી જમીનને લાગુ રસ્તાથી મળતા પ્રવેશ તથા તેની હ્યાતી, કાયદેસરતા, વર્ગીકૃતતા અને પહોળાઈ બાબતે બાબતે સક્ષમ અધિકારીશી દ્વારા ચકાસણી કરાવી લેવાની રહેશે. તથા રસ્તાની મધ્યરેખાથી બાંધકામ સંદર્ભે છોડવી પડતી બાંધકામ રેખા તથા નિયંત્રણ રેખાના નિયમોનું પાલન કરવાનું રહેશે. અન્યથા સદર અભિપ્રાય રદ ગણાશે.
૨૬. આ અભિપ્રાય અરજદારશી, એન્જિનિયરશી/ આર્કિટેક્ટશી/ રજુ કરનાર એજન્સી દ્વારા રજુ કરવામાં આવેલ વિગતોના આધારે આપવામાં આવેલ છે રજુ કરેલ વિગતોમાં વિસંગતતા ઉદ્દેશ્ય/ એકપણ કે તેથી વધુ વિગતો ખોટી હોવાનું જાહેર થયેથી આ અભિપ્રાય રદ થયેલ ગણાશે. તેમજ તેની સઘળી જવાબદારી અરજદારશી, એન્જિનિયરશી/ આર્કિટેક્ટશી/ રજુ કરનાર એજન્સીની રહેશે.
૨૭. સવાલવાળી જમીનના તમામ સ.ન. અંગે ૭/૧૨, તમામ એન્દ્રી, સત્તા પ્રકાર, પોત ખરાબો, માપણી શીટ, સંપાદિત જમીનોના ક્ષેત્રફળની ચકાસણી તથા સવાલવાળી જમીનની માલિકી, ક્ષેત્રફળ, ફદ્દ માપ, ૭/૧૨ના ઉતારા, બીજા ફક્ક, ફક્ક પત્રક, નોંધ, કોઈ મેટર, વાંધા વિવાદ, કુલમુખત્યારનામુ, ફક્ક/હિત, રસ્તા કરાર, રસ્તાની અધિકૃતતા/ઉપલબ્ધતા, પ્રવેશ સવાલવાળી જમીનમાં કોઈ દાવો થયેલ હોય તો તમામ બાબતોની ચકાસણી વિનયેતી/બાંધકામની મંજૂરી આપતા સમયે જે તે સક્ષમ અધિકારીશી મારફતે કરાવી લેવાની રહેશે.
૨૮. સદરું જમીન/મિલકત અંગે કોઈ કોઈ વિવાદ કે લવાદ હોઈ તો જે તે સંલગ્ન કોઈના નિર્ણય તથા સંબંધિત કાયદાની જોગવાઈઓને આધિન રહેશે.
૨૯. સવાલવાળી જમીનમાં આચોજન કરેલ સૂચિત બાંધકામ અંગે પર્યાવરણ ની જગતવણી માટે નિયમાનુસાર સૌ પ્રથમ સંબંધિત અધિકારીશીનો અભિપ્રાય મેળવી લેવાનો રહેશે. ત્યાર બાદ જ આગામી કાર્યવાહી કરવાની રહેશે.
૩૦. સવાલવાળી જમીનને નદી/ કેનાલ/ વહેળા/ તળાવ વિગેકેની અસર થતી હોઈ તો મધ્ય કે ફદ્દ રેખાથી છોડવા પડતા માર્જિન અંતરો બાબતે નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવણ અને કલ્યાસર વિભાગ સચિવાલયના તા.૧૧/૦૮/૨૦૧૮ના પરિપત્ર કમાંક :એમ.આઇ.એસ./૧૦૨૦૧૦:૧૭૧-૫ ની જોગવાઈઓ ચુસ્તપણે અમલ કરવાનો રહેશે અને તે અંગે જરૂરી સુધારા કરવાના થતા હોય તો કરાવી, સંબંધિત ખાતાનો સૌપ્રથમ અભિપ્રાય મેળવી લેવાનો રહેશે.
૩૧. સવાલવાળી જમીનની આજુબાજુમાં અભયારણ્ય, જૈલ, એરપોર્ટ, એસ.આઇ.આર., આર્કિયોલોજી કે અન્ય વિભાગને લગતા કાયદાઓ/ નિયંત્રણો અન્વયે અરજદારશીએ સૌ પ્રથમ ના-વાંધા પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે. ત્યારબાદ જ આગામી કાર્યવાહી કરવાની રહેશે.
૩૨. સવાલવાળી જમીનમાં રજુ કરેલ બાંધકામ અંગે સંબંધિત વિભાગ/ સરકારી/ અર્ધસરકારી/ નિગમો/ બોર્ડ વિગેરે તરફથી મેળવવાના થતા " ના વાંધા પ્રમાણપત્ર " મેળવી લેવાના રહેશે. તથા તે પછી જ બાંધકામની મંજૂરી સંબંધિત કચેરી દ્વારા આપવાની રહેશે.
૩૩. સદર જમીનમાં સત્તામંડળ/ ઓથોરીટી દ્વારા એમના વિસ્તારના તથા બહારના વિસ્તાર માટે કોઈપણ આચોજન જેમ કે રોડ નેટવર્ક વિગેરે ચાલતી હોઈ અથવા ભવિષ્યમાં થનાર હોઈ અને એની અસર સવાલવાળી જમીનને થશે તો તે મુજબ સંપાદન/ કપાત થતી હોઈ તે ધ્યાને લઈ સદર નક્શા રીવાઈડ કરવાના રહેશે.
૩૪. સોલીડ વેસ્ટ તથા વોટર ડિસ્પોઝલ માટે સોઈલ સ્યુટેબલીટી રિપોર્ટે આનુસંભિક ફાયજુનિકલી ડિસ્પોઝલ તથા મેઈન્ટેનન્સની ચોગ્ય વ્યવસ્થા સહનું આચોજન અને અમલીકરણ કરવાની સંપૂર્ણ જવાબદારી ડેવલપર/ જમીન માલિકની રહેશે. પ્રશ્નવાળી જમીનમાં સૂચિત વિકાસ અન્વયે તમામ અંતરમાળખાડીય સવલતોનો વિકાસની જગતવણી/ નિભાવણી કરવાની જવાબદારી ડેવલપર/ જમીન માલિકની રહેશે.
૩૫. સ્યુએજ વેસ્ટ વોટરનું પૂર્ણ વૈજ્ઞાનિક ઢબે શુદ્ધિકરણ કરી, સદર શુદ્ધ થયેલ પાણીનો નિકાલ પ્રશ્નવાળી જમીનમાં જ બાગ-બગીચા વિગેરે માટે થાય તેમ 'ઝીરો વેસ્ટ વોટર આઉટ સાઈડ ડિસ્પોઝલ'નું આચોજન અને અમલીકરણ કરવાની સંપૂર્ણ જવાબદારી ડેવલપર/ જમીન માલિકની રહેશે.
૩૬. સરકારશીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા.૧૨/૧૦/૨૦૧૭ ના અધિસૂચના કમાંક: જુલેચ/વી/ ૨૦૧૭ નો ઇડીબી-૧૦૨૦૧૬-૩૬૨૮-લ થી પ્રસિદ્ધ થયેલ સંકલિત સામાન્ય વિકાસ નિયંત્રણ નિયમોની જોગવાઈઓ તથા વખતો વખત તેમા થયેલ સુધારા-વધારા અનુસાર વરસાની પાણીના બુગર્લ વહન/ સંચય માટે તથા વૃક્ષા રોપણ/ વનીકરણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા બાબતની ઘટિત કાર્યવાહી નક્શા મંજૂર કરવાની સત્તા ધરાવતા સત્તા તંત્ર દ્વારા કરવાની/ કરાવવાની રહેશે. તે મુજબ અમલ કરાવવાનો રહેશે.
૩૭. સદર બાંધકામ બાબતે, અધિકૃત સંસ્થામાંથી સવાલવાળી જમીનનો સોઈલ ટેસ્ટીંગ રીપોર્ટ મેળવી તે મુજબ સ્ટ્રક્ચરલ ડિઝાઇન તૈયાર કરી અરજદારશી/ ડેવલોપરસશી/ જમીનમાલિકશી એ બાંધકામ કરવાનું રહેશે.

૩૮. ફાયર સેફ્ટી માટે સરકારશી દ્વારા બનાવવામાં આવેલ અમતી કાયદા / નિયમોનુસાર અરજદારશી/ડેવલોપર્સશીએ જરૂરી વ્યવસ્થા કરવાની રહેશે તથા તે અંગેનું જરૂરી "ના વાંધા પ્રમાણપત્ર" જે તે સખ્તમ અધિકારીશી પાસેથી અચુકપણે પોતાની જવાબદારીએ મેળવી લેવાનું રહેશે અને ત્યારબાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવાની રહેશે.
૩૯. નેશનલ બિલ્ડિંગ કોડ-IS-2470 તથા CGDCR Part- III ના નિયમ ૧૩.૧૦.૧ મુજબ સેપ્ટીક ટેન્ક તથા સોક પીટનું આયોજન કરવાનું રહેશે. અને તે અંગેની સંપૂર્ણ જવાબદારી આર્કિટેક્ટ/એન્જિનિયર/ડેવલોપર્સ/જમીન માલિકશીએ ઉપયોગ શરૂ કરતાં અગાઉ પોતાના ખર્ચે કર્યા બાદ ઉપયોગ શરૂ કરી શકાય તેવી જોગવાઈ કરવાની રહેશે.
૪૦. સવાલવાળી જમીનથી મુજબ રસ્તા સુધી પાકા રસ્તાની વ્યવસ્થા જમીન માલિકશીએ ઉપયોગ શરૂ કરતાં અગાઉ પોતાના ખર્ચે કર્યા બાદ ઉપયોગ શરૂ કરી શકાય તેવી જોગવાઈ કરવાની રહેશે.
૪૧. સવાલવાળી જમીનમાં સરકારશીના મંજુર/અમલી નિયમો જીમકે સી.જી.ડી.સી.આર., ફાયર રેગ્યુલેશન વિગેરેની બાંધકામ સંબંધિત, લે-આઉટના આયોજન સંબંધિત, ટ્રી-પ્લાનેશન, પરકોલેટીંગ વેલનું આયોજન વિગેરેની બાબતોનું અચુક પાલન કરવાનું રહેશે.
૪૨. ખુલ્લી રહેતી જમીનો અંગે જે તે સત્તામંડળના વખતો વખતના નિયમો અને વિકાસ યોજના/નગર રચના યોજનાના નિયંત્રણો લાગુ પાડવાના રહેશે.
૪૩. સરકારશીના વખતો વખતના નિયમો અને નિયંત્રણોનું યોગ્ય રીતે પાલન કરવાનું રહેશે.
૪૪. ચાર્જબલ F.S.I. ના ઉપયોગ માટે સરકારશી દ્વારા મંજુર કરવામાં આવેલ CGDCR-2017 તથા વખતો-વખતના અન્ય નિયમોની જોગવાઈઓને આધીન સદર ચાર્જબલ F.S.I. ની નિયમોનુસાર વસુલવાની થતી ફી સ્થાનિક સત્તામંડળ/સંબંધિત કચેરી દ્વારા સૌંધયમ વસુલ કરી લેવાની રહેશે. ત્યારબાદ જ બાંધકામ પરવાનગી આપવાની રહેશે. જે અરજદારશીને બંધનકર્તા રહેશે.
૪૫. કાર્યપાલક ઈજનેર, મા.મ.પંચાયત વિભાગ, અમદાવાદના જા.ન./ડીપી/બકમ/સીબી/વશી ૫૭/૨૦૨૪, તા.૧૨/૫/૨૦૨૪ ના અભિપ્રાય મુજબ બાંધકામ રેખા તથા નિયંત્રણ રેખા બાબતોના નિયમો તથા શરતોનું પાલન કરવાનું રહેશે.

આમ, મોજે.રતનપુર, તા.:દંધુકા, જી.:અમદાવાદ. સી.સ.ન.ના.૩૩૬માં બિનખેતી અંગે લે-આઉટના

પ્લાનના શરતી તાંત્રીક અભિપ્રાય બાબતેના નકશાની બે નકલો આ સાથે સામેલ છે, જે વિદિત થાય.

**બિડાણ: ઉપર મુજબ.** અને રજૂ થયેલ પ્લાનમાં સાંચી ટોકા કરેલ સ્ટ્રક્ચરલ  
એન્જિનિયરશી, આર્કિટેક્ટશીના નામ પ્રોજેક્ટના સાહિત્ય  
નોમરમાં તથા સ્થળે સાઈન બૉર્ડ ઉપર દર્શાવવાના રહેશે.



નકલ સંવિનય રવાના:

જિલ્લા કલેક્ટરશી, અમદાવાદ તરફ જાણ તથા જરૂરી કાર્યવાહી સારૂ.